

માત્રે દદય



કાર્ડિયોલોજીસ્ટ

ડૉ. વિનીત સાંખલા +૯૧-૮૮૨૪૦ ૧૫૦૫૬	ડૉ. મિલન ચગ +૯૧-૮૮૨૪૦ ૨૨૧૦૭
ડૉ. વિપુલ કપૂર +૯૧-૮૮૨૪૦ ૯૯૮૮૮	ડૉ. અર્મિલ શાહ +૯૧-૮૮૨૪૦ ૬૬૬૭૮
ડૉ. તેજસ વી. પટેલ +૯૧-૮૮૪૦૩ ૦૪૧૩૦	ડૉ. હેમાંગ બશી +૯૧-૮૮૨૪૦ ૩૦૧૧૧
ડૉ. હિરેન કેવડીયા +૯૧-૮૮૨૪૪ ૬૫૨૦૫	ડૉ. અનિશ ચંદ્રચંદ્ર +૯૧-૮૮૨૪૦ ૬૬૬૨૨
ડૉ. ગુણવંત પટેલ +૯૧-૮૮૨૪૦ ૬૧૨૬૬	ડૉ. અભય નાઈક +૯૧-૮૮૨૪૦ ૮૨૬૬૬
ડૉ. કેપૂર પરીખ +૯૧-૮૮૨૪૦ ૨૬૫૫૮	ડૉ. સત્ય ગુપ્તા +૯૧-૮૮૨૪૦ ૪૫૭૮૦

પીડિયાટ્રીક કાર્ડિયોલોજીસ્ટ

ડૉ. કશ્યપ શેઠ +૯૧-૮૮૨૪૬ ૧૨૨૮૮	ડૉ. મિલન ચગ +૯૧-૮૮૨૪૦ ૨૨૧૦૭
ડૉ. દિવ્યેશ લાંદેવાળા +૯૧-૮૨૩૮૩ ૩૬૬૬૦	

કાર્ડિયોક્ષર્ચ સર્જન

ડૉ. વીરેન શાહ +૯૧-૮૮૨૪૫ ૭૫૮૭૭

ડૉ. ધવલ નાયક +૯૧-૮૦૮૮૧ ૧૧૧૩૩

ડૉ. તિશોર ગુપ્તા +૯૧-૮૮૧૪૨ ૮૯૦૦૮

પીડિયાટ્રીક અને સ્રોક્યર્લ હાર્ટ સર્જન

ડૉ. શૈનક શાહ +૯૧-૮૮૨૪૦ ૪૪૪૦૨

કાર્ડિયોવાસ્ક્યુલર, થોરાસ્ટીક અને

થોરાકોસ્કોપીક સર્જન

ડૉ. પ્રાવા મોઢી +૯૧-૮૮૨૪૦ ૮૪૭૦૦

કાર્ડિયોક એનેસ્થેટીસ્ટ

ડૉ. નિરેન ભાવસાર +૯૧-૮૮૭૭૫ ૭૧૮૧૭

ડૉ. હિરેન ધોળકિયા +૯૧-૮૫૪૬૩ ૭૫૮૧૮

ડૉ. ચિંતન શેઠ +૯૧-૮૧૭૩૨ ૦૪૪૪૪

કાર્ડિયોક ઇલેક્ટ્રોફિલોલોજીસ્ટ

ડૉ. અભય નાઈક +૯૧-૮૮૨૪૦ ૮૨૬૬૬

ડૉ. વિનીત સાંખલા +૯૧-૮૮૨૪૦ ૧૫૦૫૬

ડૉ. હિરેન કેવડીયા +૯૧-૮૮૨૪૪ ૬૫૨૦૫

નીઓનેટોલોજીસ્ટ અને પીડિયાટ્રીક ઇન્ટેન્સીવિસ્ટ

ડૉ. અમિત ચિંતલીયા +૯૧-૮૦૫૫૫ ૮૭૪૦૦



CIMS[®]

CARE INSTITUTE OF MEDICAL SCIENCES

Earning Trust with World-Class Practices



મીનીમલી ઈન્વેસીવ કાર્ડિયાક સર્જરી (મીક્સ)

જેમ વિશ્વ વિશાળમાંથી નાનું બની રહ્યું છે તે જ શીતે કાર્ડિયાક સર્જરી પણ મેક્સિમલી ઈન્વેસીવમાંથી મિનીમલી ઈન્વેસીવ બની રહી છે.

આપણે જો કાર્ડિયાક સર્જરીનો ધર્તિહાસ જોઈએ તો જણાશે કે એ માત્ર ૧૦૦ વર્ષ જ જૂનો છે. ઉદા. જોઈએ તો,

- પ્રથમ સફળ હાર્ટ ઓપરેશન: રેહન, ૧૮૮૬, હાર્ટના જખમમાં પ્રથમ વખત ટાંકા લેવાયા
- પ્રથમ પીડીએ કલોગ્ર ગ્રોસ દ્રારા ૧૯૩૮માં
- પ્રથમ એએસડી કલોગ્ર રોસ દ્રારા ૧૯૪૮માં
- હાર્ટ લંગ મશીનનો પ્રથમ વખત વપરાશ ૧૯૫૩માં
- પ્રથમ સફળ બાયપાસ સર્જરી ૧૯૬૩માં
- પ્રથમ રોબોટીક સર્જરી કાર્પેન્ટીયર દ્રારા ૧૯૮૮માં

હાર્ટ એક સતત ગતિશીલ અને ક્રિયાશીલ અંગ છે અને સાથે સાથે તે શરીર માટે ખૂબ સંવેદનશીલ અને મહત્વનું અંગ છે. કાર્ડિયાક સર્જરી દરમયાન ખૂબ



ચોકસાઈ જરૂરી છે, માટે અત્યાર સુધી એન્ડોસ્કોપીક અથવા થોરાકોસ્કોપીક કાર્ડિયાક સર્જરી લેપ્રોસ્કોપી સર્જરી જેટલી વિકસિત નથી થઈ. કાર્ડિયાક સર્જરીમાં ગફ્ફલતને સ્થાન નથી. ૫ વર્ષથી મિનીમલી ઈન્વેસીવ કાર્ડિયાક સર્જરીનો ઉદ્દ્દેશ થયો છે જેમાં આશાયક પરિણામ મળ્યાં છે. વધુ ને વધુ કાર્ડિયાક પ્રક્રિયા આ એમાર્યાસીએસ (MICS) દ્રારા થાય છે. એમાર્યાસીએસ શીખવામાં લાંબો સમય લાગતો હોવાથી અને ટેકનિકલી ડિમાન્ડીંગ હોવાથી વિશ્વ સ્તરે તેને વ્યાપક માન્યતા મળી નથી. ભારતમાં પણ ૧-૨ વર્ષથી જ તેમાં વેગા આવ્યો છે અને ધીમે ધીમે કાર્ડિયાક સર્જરી ક્ષેત્રનો ભાગ બની રહ્યું છે.

હાર્ટ સર્જરીનો પરંપરાગત અભિગમ

સ્ટાન્ડર્ડ મિડલાઈન સ્ટર્નોટોમી ચીરો કે જેમાં (છાતીનું હાડકું) ગરદનથી ઉપરના પેટ સુધી તેને પૂરું ચીરવામાં આવે છે. સામાન્યપણે ૮ થી ૧૦ ઈંચ લાંબો મિડલાઈન ચીરો મૂકવામાં આવે છે.

પરંપરાગત અભિગમના ફાયદા

1. હાર્ટ સર્જનના હાથમાં છે એટલે સ્થિતિ નિયંત્રણ હેઠળ રહે છે.
2. સર્જન તમામ જટિલ અને જોખમી પ્રક્રિયા કરી શકે છે.
3. ઓપરેશન ટેબલ પર ઉભી થતી કોઈ પણ સમસ્યાને પહોંચી વળવા સક્ષમ

૪. ભૂતકાળના સર્જનની તાલીમ આ અભિગમ સાથેની હોઈ સર્જન સ્વર્થ અને આશ્રમટ હોય છે.


પરંપરાગત અભિગમના ગેરકાયદા

૧. પાંસળીના ફેકચરને કારણે પીડા અને વર્ટખો કોસ્ટલ સાંધામાં દબાણાને કારણે પીઠમાં પીડા
૨. ધામાં સમસ્યા અને છાતીના હાડકામાં ચેપ લાગવાનો ઉંચો દર
૩. છાતીના હાડકાને કાપવું ફેકચર ગણાય છે અને તેથી સંપૂર્ણ રિકવરી માટે ૩ માસનો પૂર્તો આરામ આપવો પડે છે અને તેથી જ ઓપન હાર્ટ સર્જરીના દર્દીઓને ભલામણ કરાયેલા તમામ નિયંત્રણો
૪. ધીમી રિકવરી અને હલનયલનમાં વિલંબને કારણે આઈસીયુ અને હોસ્પિટલમાં લાંબુ રોકાણ
૫. કોસ્મેટિક સમસ્યાઓ ખાસ કરીને ચુવાન દર્દીઓમાં
૬. મોટા ડાઘ સંબંધિત સમસ્યાઓ જેવી કે કેલોઇડસ, વાયર સાયનસ, ન્યુરોલોજિકલ પીડા વગેરે

મીનીમલી ઈન્વેસિવ કાર્ડિયાક સર્જરી (એમઆઈસીએસા)

પાછળનો હેતુ

મીનીમલી ઈન્વેસિવ કાર્ડિયાક સર્જરી પાછળનો હેતુ કાર્ડિયાક ઓપરેશનની પરંપરાગત પદ્ધતિ સાથે સંબંધિત ઉદાસી ધટાડવાનો છે. ઉદાસી ધટાડવાનો અમારો અર્થ છે ઓપરેશનના કારણે દર્દી ઉપર થતી અસરો ઓછી કરવી.



એમઆઈસીએસની વ્યાખ્યા

મીનીમલી ઈન્વેસિવ કાર્ડિયાક સર્જરી એટલે છાતીના હાડકાને કાચા વિના અથવા નાના ચીરા દ્રારા છાતીના હાડકાને અંશત: કાપીને કરાતી કાર્ડિયાક સર્જરી.

સર્જરીની અસરો ઓછી કરવાના કેટલાંક ઉપાય છે.

૧. એક માર્ગ છે છાતીના હાડકાને કાપવાનું ટાળવું. આમ કરવાથી દર્દી કામ પર કે સામાન્ય પ્રવૃત્તિઓ પર જલ્દી ચઢી શકે છે, પીડા ઓછી થાય છે અને છાતીના હાડકાને ચેપની શક્યતા ઓછી થાય છે. મોટા ભાગના વેલ્વ્યુલર ઓપરેશનમાં અને અમુક કોરોનરી બાયપાસ ઓપરેશનમાં સ્ટન્ઝોમી ટાળી શકાય છે.

આમાં છાતીના હાડકાને કાપવાનું નહીં હોવાથી હાડકાની જગ્યાએ કોમળ ટીશ્યુઓને જ રૂગવવાના રહે છે, પરિણામે પીડા ઓછી થાય છે અને ઓપરેશન પછીની રીકવરી જરૂરી થાય છે.

૨. કાર્ડિયાક સર્જરીની અસર ઓછી કરવાનો અન્ય માર્ગ છે હાર્ટ લંગ મશીન એટલે કે કાર્ડિયોપલોનરી બાયપાસ મશીનનો ઉપયોગ ટાળવાનો. હાર્ટ લંગ મશીનના ઉપયોગ સાથે અમુક સમસ્યાઓ જેવી કે, સ્ટ્રોક, ચાદશક્તિ ઓછી થવી, કિડની ફેર્લ્વ્યોર, લંગ ફેર્લ્વ્યોર અને રક્તસ્વાદ સંકળાયેલી છે. જો કે હાર્ટ લંગ મશીન વાલ્વ રિપ્લેસમેન્ટ, એએસડી (ASD) કલોગ્રર અથવા જન્મજાત હાર્ટ રોગો જેવા ધણા હાર્ટ ઓપરેશનમાં આવશ્યક છે, તેમ ઇતાં સૌથી સામાન્ય કાર્ડિયાક ઓપરેશન-કોરોનરી આર્ટરી બાયપાસ ઓપરેશન જેવાં અન્ય ઓપરેશનમાં તેને ટાળી શકાય છે.

ઓફ-પંપ કોરોનરી રીવાસ્ક્યુલરાઈઝેશન વીથ એન્ડોસ્કોપિક વેસલ હાર્સ્ટેંટિંગ

- બીટીંગ હાર્ટ સીએબીજું એન્ડોસ્કોપિક વેઇન હાર્સ્ટેંટ અથવા રેડિયલ આર્ટરી હાર્સ્ટેંટિંગ
- સીએબીજુ (CABG) સાથે સંબંધિત ચિંતા ધટાડવા સર્વગ્રાહી અભિગમ
- સર્જિકલ રીવાસ્ક્યુલરાઈઝેશન માટે ઓછી કાપ-કૂપીનો વિકલ્ય

નોન-સ્ટન્ઝોમોભી અભિગમ

આ અભિગમમાં પૂરી લંબાઈની મિડલાઈન સ્ટન્ઝોમોભી ટાળવામાં આવે છે. એને બદલે પાંસળીઓ વરદે/થોરાકોભી અભિગમનો ઉપયોગ કરાય છે જેમાં કોઈ હાડકું કાપવાનું રહેતું નથી અથવા સરેરાશ માત્ર ૩-૪ ઇંચના ચીરા સાથે અંશત: સ્ટન્ઝોમોભી કરાય છે.

એમઆઈસીએસ અભિગમનો ઉપયોગ કરી થતી પ્રક્રિયા

૧. રાઈટ થોરાકોભી દ્રારા આટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટ કલોગ્રર (હૃદયમાં જન્મથી જ કાણું)
૨. રાઈટ થોરાકોભી દ્રારા માઈટ્રલ વાલ્વ રિપેર અથવા રિપ્લેસમેન્ટ (વાલ્વનો રોગ)
૩. અંશત: અપર સ્ટન્ઝોમોભી અથવા નાની રાઈટ થોરાકોભી દ્રારા એએટોટીક વાલ્વ રિપ્લેસમેન્ટ
૪. ડાબી ઈન્ટરનલ મેમારી આર્ટરી અને રેડિયલ આર્ટરીનો ઉપયોગ કરી ડાબી તરફ ૪-૫ ઈન્ટરકોસ્ટલ દ્રારા સીંગાલ અથવા ડબલ વેસલ બીટીંગ હાર્ટ સીએબીજુ.

આ સર્જરી માટે પરિવર્તન

એમાઈસીએસ માં ઓપન હાર્ટ પ્રક્રિયામાં પરંપરાગત સીધી ઉપરી એઓર્ટા અને જમણા એટ્રીયમના કેન્દ્રુલેશનને બદલે કાર્ડિયોપલ્બોનરી બાયપાસ (CPB) વિવિધ માર્ગ દ્વારા સ્થાપવામાં આવે છે. અહીં (SVC) એસવીસી ગરદનમાં પંક્તચર કરી કેન્દ્રુલેટ કરાય છે અને (IVC) અનેએઓર્ટા ફેમરલ માર્ગથી કેન્દ્રુલેટ કરાય છે. આ ટેકનિકમાં વિશેષ સાધનો અને કેન્દ્રુલાસ તથા Trans Esophageal Echocardiogram (TEE) ની ઓપરેશન રૂમમાં જરૂર પડે છે અને વિશેષ તાલીમ માંગી લે છે. તમામ કેન્દ્રુલાસ ઓપરેટીવ એરિયાની બહાર હોવાથી સર્જરી માટે માત્ર વર્કિંગ સ્પેસની જરૂર પડે છે અને તેથી વિશેષ લાંબા સાધન વડે 3-4 દંચના ચીરા દ્વારા થર્ડ શકે છે.

એમાઈસીએસ એપ્રોચના ફાયદા

- ઓછી વાદ-કાપવાળી પ્રક્રિયા, તેથી ઓછી પીડા
- આઈસીયુ અને હોસ્પિટલમાં ટૂંકુ રોકાણ
- ઉંચુ બોખમ ધરાવતા દર્દીઓ કે જેમના ફેફસાં ખરાબ હોય અથવા સ્ટ્રોક આવ્યો હોય તેમના માટે ઈરછનીય
- જલદી હલનચલન, સ્ટ્રોક પછીના દર્દીઓ માટે ખાસ કરીને મહત્વનું
- વહેલી રિકવરીને લીધે રોજિંદી પ્રવૃત્તિઓ માં વહેલા લાગી શકાય છે. માટે ઇલેક્ટ્રોશીયન, સુથાર, ડ્રાઇવર વગેરે જેવાં રોજમદારો એક મહિનાની અંદર જ તેમનું કામ શરૂ કરી આજુવિકાસ માઈ શકે છે.
- સારં કાર્ડિયાક રિફેન્સીલીટેશન
- સુંદરતાને ક્ષતિગ્રસ્ત કર્યા વિનાની સારવાર-મહિલાઓમાં બ્રેસ્ટ કીઝ પર અને થાઈ ફોડ પર જ્ખમનો ડાધ પડે છે. માટે, ડાધ દેખાતો જ નથી. ચુવાન મહિલાઓ પૂરા વિશ્વાસ સાથે આ સર્જરી કરાવી શકે છે અને કોઈ પણ પ્રકારની લઘૃતાગ્રથી વિના કેશનેબલ વણો પહેરી શકે છે.

એમાઈસીએસ માટે દર્દીઓની પસંદગીનો માપદંડ

- તમામ નિર્દ્દિશિત દર્દીઓ, અગાઉ ચર્ચા કરી તે તમામ
- ચુવાન વચ્ચે ઈરછનીય
- સામાન્ય પેરિફરલ વાર્કયુલર સિસ્ટમ
- સંબંધિત કો-પેથોલોજીની ગેરહાજરી અને અહીં ઓપરેશન અગાઉનું
- ચોગ્ય મૂલ્યાંકન ખૂબ જરૂરી છે કે જેથી ઓપરેટીંગ ટેબલ પર કોઈ અણાદારી ઘટના ન બને.
- દર્દીની ઈરછા


શું એમાઈસીએસ બધા માટે શક્ય છે?

એમાઈસીએસ નિર્માણિત દર્દીઓ માટે શક્ય નથી કે જેમને :

- મલ્ટીપલ પેથોલોજી હોય
- પેરિફરલ વાર્કયુલર રોગ
- સંબંધિત પ્રકૃતિદંત વિલક્ષણાતા
- જમણી બાજુ ગ્રાફ્ટીંગ મુશ્કેલ હોવાથી સીએબીજીના કેસમાં મલ્ટીવેસાલ રોગ
- ખૂબ મેદસ્વી દર્દીઓ પર થોરાકટોમી કરવી મુશ્કેલ હોય છે.

સીમ્સ હોસ્પિટલમાં અમારો અનુભવ

- અમદાવાદ અને પશ્ચિમ ભારતમાં સંપૂર્ણ સુસજ્જ એમાઈસીએસ પ્રોગ્રામ શરૂ કરનાર પ્રથમ અધિકૃત સેન્ટર
- અત્યાર સુધીમાં ૨૦૦૦ કેસો થી વધારે
- ભારતમાં સૌ પ્રથમ હાઇબીક બાયપાસ
- એમાઈસીએસથી ઓપરેટ કરાયેલા દર્દીઓમાં અન્ય સેન્ટરની સરખામણીએ ઉર્ચય ગુણવત્તા વાળું (સ્ટાન્ડર્ડ) પરિણામ



તારણ

અંતમાં એટલું જ કે, સર્જનો પાસે નવી ટેકનિક આવી છે અને તેનો ફાયદો દર્દીઓને છે. એવી ટેકનિક કે જે હાર્ટ સર્જરી ના પસંદગીના દર્દીઓમાં પીડા અને રિકવરી સમયમાં ઉલ્લેખનીય દાટાડો કરે છે. એમાઈસીએસ કાર્ડિયાક દર્દીઓ માટે હકીકતમાં વરદાન છે કે જે ચુવાન દર્દીઓમાં ચિંતા ઓછી કરી પરિણામ સુધારે છે. ચોક્કસપણે એ બધાં જ દર્દીઓ માટે નથી પણ પસંદગીના દર્દીઓ માટે એ એક સારો વિકલ્પ છે. જૂની સર્જરી સામે નવો અભિગમ છે અને નવા ઓપરેશન છે, જેમાં દર વર્ષે હજારો દર્દીઓના પરિણામ સુધારવાની ક્ષમતા રહેલી છે. આ પ્રવાહ જારી રહેશે અને સાથે જારી રહેશે જૂની સમસ્યા માટે નવી ટેકનોલોજીનો વિકાસ અને નવા ઉકેલ.

કોરોનારી આર્ટરી ડિગ્રી શું છે ?

આ રોગમાં હદયના સ્નાયુઓને લોહી અને ઓક્સિજન પહોંચાડતી ધમનીઓ (કોરોનારી આર્ટરી) સાંકળી થઈ જાય છે જેના કારણે તે સ્નાયુઓને પૂરતું લોહી મળી શકતું નથી.

આના કારણે,
છાતીમાં દુખાવો,
હદય રોગને હુમલો,
હાર્ટ ફેલ્યોર અને
હાર્ટ રિધમ
પ્રોઝ્લેમ્સ જેવી તકલીફો
થઈ શકે છે.

આ સૌથી
સામાન્ય પ્રકારનો
હદય રોગ છે.

આ રોગના કારણે,
વર્ષ 3.૭૦ લાખ
થી વધુ લોકોની
મૃત્યુ થાય છે.



હાંસ ચટવો /
શ્વાસ લેવામાં
તકલીફ પડવી

થાક લાગવો

આ રોગના ચિનહો અને સામાન્ય લક્ષણો વિષે જાણો



હાર્ટ એટેક
આવવો

ભેબકા આવવા
અથવા ઉલટી થવી

મ્યુકોરમાઇકોસીસ શું છે ?

સાવધાન રહો. જગૃત રહો.

મ્યુકોરમાઇકોસીસ એ એક પ્રકારનો ફંગાલ ઈન્ફેક્શન છે જે દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે પરંતુ આ બધા વરચે કોવિડ-૧૯ દર્દીઓ અને મહામારી થી સાબા થઈ ચૂકેલા લોકોમાં જોવા મળે છે.

સીમ્સ મ્યુકોર કિલનિક

મલ્ટી-ડિસિલિનરી વિશેષજ્ઞોની ટીમ દ્વારા સારવાર

મ્યુકોરમાઇકોસીસ ને “બ્લેક ફંગાસ” તરીકે પણ ઓળખાય છે.

તે સામાન્ય રીતે સાઈનસ, નસલ મ્યુકોસા, ઓરલ મ્યુકોસા, ઉપર જડબા, આંખ અને ફેફસાને અસર કરે છે.

કોવિડ-૧૯ દરમિયાન બધા ચિંતિત છે પણ, આ લક્ષણોને અવગાણશો નહીં

સિસ્ટિક કાર્ડિયાક સાયન્સ

જડપ થી સારવાર મેળવો

નીચેના લક્ષણો જોવા મળે તો
કૃપા કરીને નજુકની હોસ્પિટલમાં પહોંચી જવું.

હાર્ટ એટેકના લક્ષણો

- છાતીમાં દુખાવો
- છાતીમાં બળતરા અથવા ભારેપણ લાગવું
- શ્વાસ લેવામાં મુશ્કેલી પડવી
- અસામાન્ય પરશેવો વળવો
- ઉબડા અને ઉલટી



24 X 7 MEDICAL HELPLINE +91-70 69 00 00 00

શેકેલી કેરીઓ સાથે રોઝવોટર અને પિસ્તાની કુલ્ફી :

Prep: 15 mins | Serves 6 Plus Freezing



સામાન્ય રીતે કુલ્ફી એવા દૂધ માંથી બનાવવામાં આવે છે કે જે ધાણા કલાકો સુધી ઉકાળવામાં આવ્યું હોય છે. આ કુલ્ફી કન્ડેન્ક્ટ દૂધ માંથી બનાવવામાં આવેલ છે.

બનાવવા માટેના જરૂરી ઘટકો :

- ૪૫૦ ગ્રામનું કન્ડેન્ક્ટ દૂધનું ટીન
- ૨ ચમચી ગુલાબ જળ
- ૫૦ ગ્રામ એકદમ બારીક સમારેલા પિસ્તા, અને સાથે પીરસવા માટે પિસ્તાના થોડા મોટા ટુકડા
- ૨૮૪ એમએલ ડબલ કીમનું ટબ
- ૩ નાની પાકેલી કેરીઓ

બનાવવાની રીત :

પગલું ૧

કન્ડેન્ક્ટ દૂધને એક બાઉલમાં કાઢો અને તેમાં ગુલાબ જળ અને બારીક સમારેલા પિસ્તા ઉમેરો અને મિશ્રિત કરો. કીમ તેનો આકાર જાળવી રાખી શકે ત્યાં સુધી તેને થોડું હળવેથી મિશ્રિત કરો, અને તે પછી પિસ્તાના મિશ્રણને તેમાં ઉમેરો અને હળવેથી મિશ્રિત કરો.

પગલું ૨

આ મિશ્રણને દુનાના રેમિકિન્સ અથવા પિરામિડ મોડકમાં રેડો. ફીજ કરો, અને પછી કિલંગ ફિલ્મ સાથે કવર કરો.

પગલું ૩

પીરસવા માટે : કેરીને તેના ગોટલાની બંને બાજુએથી કાપીને તેના દુભાગ કરો, પરંતુ તેની છાલ ન કાઢો. કેરીની ચીરના દળમાં કાઇસ-કોસ બનાવો, પરંતુ તેની છાલ ન કપાય જાય તેનું દ્યાન રાખો. તમે આ કેટલાક કલાકો અગાઉથી કરી રાખી શકો છો. કેરીની ચીરની અંદરની બાજુને, તે કેરેમલાઇઝ કરવાનું શરૂ ન કરે ત્યાં સુધી બાર્બેક્યૂ પર પકાવો. તેને એમને એમ રહેવા દો અથવા તે કેરેમલાઇઝ થયેલ ભાગો સરખી રીતે દેખાય શકે તે માટે દરેક ચિરાને બહારની બાજુએ વાળી લો. પિસ્તા છૂટા છૂટા રાખેલ હોય તેની સાથે કુલ્ફીને સર્વ કરો (અને જો તમને ગમતું હોય તો એક લીંબુ સિક્કિવર્જ કરો).

જો તમારે ડૉક્ટર કન્સલ્ટેશન ની જરૂર છે,
તો કૃપા કરીને વિલંબ ન કરો.

CIMS CALLDOC****

ટેલી કન્સલ્ટેશન

આજે જ અપોઇન્ટમેન્ટ બુક કરો

ફોન પર +91 70690 49567 સવારે 9:30 થી સાંજે 6.00, સોમ થી શનિ
અથવા ઈ-અપોઇન્ટમેન્ટ પર (www.cims.org)

અમે ટૂંક સમયમાં તમારો સંપર્ક કરીશું

તમારા સ્વાસ્થ્યને અવગાળાશો નહીં
સિમ્સ ઈસ્ટ (નોન-કોવિડ) હોસ્પિટલ

બધી જ મલ્ટી-ડિસિલિનરી મેડીકલ અને સર્જુકલ સેવાઓ ઉપલબ્ધ



અપોઇન્ટમેન્ટ :+91-79-4805 1008 | +91-98250 66661

દર્દીની સલામતી માટે વિશેષ પ્રોટોકોલનું કાંકપણે પાલન

"Maru Hriday" Registered under RNI No. GUJGUJ/2009/28044

Published 15th of every month

Permitted to post at PSO, Ahmedabad-380002 on the 22nd to 27th of every month under

Postal Registration No. GAMC-1731/2019-2021 issued by SSP Ahmedabad valid upto 31st December, 2021

Licence to Post Without Prepayment No. PMG/HQ/090/2019-2021 valid upto 31st December, 2021

If undelivered Please Return to :

CIMS Hospital, Nr. Shukan Mall,

Off Science City Road, Sola, Ahmedabad-380060.

Ph. : +91-79-2771 2771-72

Fax: +91-79-2771 2770

Mobile : +91-98250 66664, 98250 66668

'મારુ હૃદય' નો અંક મેળવવા અંગો : જો તમારે 'મારુ હૃદય' નો અંક જોઈતો હોય તો તેની કિંમત રૂ. ૬૦ (૧૨ અંક) છે. તેને મેળવવા માટે કેશ અથવા ચેક/ડિડી 'સીમ્સ હોસ્પિટલ પ્રા. લી.' ના નામનો તમારા નામ અને તમારા પુરતા એડ્રેસની વિગત સાથે અમારી ઓફિસ, "મારુ હૃદય" ડિપાર્ટમેન્ટ, સીમ્સ હોસ્પિટલ, શુકન મોલ નજીક, ઓફ સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ-૩૮૦૦૬૦ પર મોકલી આપશો. ફોન નં. : +૯૧-૭૯-૪૮૦૫ ૨૮૨૩



THE WORLD'S BEST HOSPITALS 2021



Certificate

Based on the results of an independent analysis, Newsweek recognizes

Care Institute Of Medical Science

as one of the
World's Best Hospitals 2021

The following parameters were taken into consideration:

Recommendations from medical experts,
patient experience & medical KPIs

Nancy Cooper
Nancy Cooper
Global Editor in Chief
Newsweek

Manuel Mörbach
CEO
Statista Inc.

Newsweek statista

તંત્રી, મુદ્રક અને પ્રકાશક ડૉ. અનિશ ચંદ્રચંદ્રાએ સીમ્સ હોસ્પિટલ વતી હારેઓમ પ્રેન્ટરી, ૧૫/૧, નાગરોરી એસ્ટેટ,
ઇ.એસ.આઈ. ડિસ્પેન્સરીની સામે, દુધેચર રોડ, અમદાવાદ-૩૮૦૦૦૪ ખાતેથી છાપ્યું અને
સીમ્સ હોસ્પિટલ, શુકન મોલ નજીક, ઓફ સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ-૩૮૦૦૬૦ ખાતેથી પ્રાસિદ્ધ કર્યું.